



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા ૧૫/૦૭/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૮૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૯ કેસ કરી, ૫૫ વ્યક્તિઓને ઝડપી, ૫૫૬ લીટર દેશી દારૂ, ૧૩૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ સ્કુટર અને ૧ છોટા હાથી ગાડી કબજે કરી હતી. જુગાર ધારા હેઠળ ૭ કેસ કરી, ૪૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૦,૨૭૭/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૮૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૧૮૬/૧૯

આનંદનગર: અતુલભાઈ મોતીભાઈ ચૌધરી (ઉ.વ.૫૪) (રહે. નંદન એપાર્ટમેન્ટ, રવિ રશ્મી સોસાયટીની ગલીમા, રામદેવનગર ચાર રસ્તા પાસે, સેટેલાઈટ) એ તા.૧૪/૭/૧૯ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે અતુલભાઈ ચૌધરીના પત્ની તા.૧૨/૭/૧૯ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે શેલ્બી હોસ્પિટલની પાછળ ગલીમા ઇશાન-૨ આગળથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ અતુલભાઈ ચૌધરીના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- ખેચી તોડી ઝુટવી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.બી.મીર ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૧૮૭/૧૯

સોલા હાઈકોર્ટ: ભાનુપ્રસાદ પુરુસોત્તમદાસ મિસ્ત્રી (રહે. ગુલાબપાર્ક ગુલાબ ટાવરની બાજુમાં, થલતેજ) એ તા.૯/૭/૧૯ બપોરના ૧૨/૩૦ વાગે હોમ ટાઉન સામે આવેલ ભાઈકાકાનગર જવાના ખાંચા પાસે પોતાની હ્યુન્ડાઈ કંપનીની આઈ ૨૦ ઇલાઈટ સ્પોર્ટ્સ કાર નંબર જીજી ૦૧ આરએસ ૫૮૨૧ કિંમત રૂપિયા ૫,૭૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી બપોરના ૩/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ ભાનુપ્રસાદ મિસ્ત્રીએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.જી.હુણ ચલાવે છે.

વીજ કરંટ લાગતા મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૧૮૮/૧૯

સેટેલાઇટ: વકારભાઇ અપુભાઇ શેખ (ઉ.વ.૨૪)(રહે.સંકલિતનગર જુહાપુરા વેજલપુર) તા.૧૩/૦૭/૧૯ સાજના ૭/૪૫ વાગ્યાના સુમારે રામદેવનગર ખાતે ઇલેક્ટ્રીક ડી.પી.નુ કામ કરતા હતા દરમ્યાન વીજ કરંટ લાગતા, સારવાર અર્થે તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૪/૭/૧૯ રાતના ૮/૨૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે સેટેલાઇટ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એસ.મહેશ્વરી ચલાવે છે.

ત્રીજા માળેથી પડી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૧૮૯/૧૯

કાગડાપીઠ: તુલસી ડો/ઓ વિશ્વભરદવાલ ગુપ્તા (ઉ.વ.૧૬)(રહે.પાર્ક એવન્યુ ફ્લેટ, ચર્ચ પાસે પંડિત નહેરૂ સ્કુલ પાસે બહેરામપુરા) તા.૧૩/૦૭/૧૯ કલાક ૬/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ત્રીજા માળે ફ્લેટની બાલ્કનીમાંથી ખાટલા ઉપર ઉભા રહી કપડા લેવા જતા, ખાટલો ખસી જતા નીચે પડી જતા ગંભીર ઇજાઓ થતા, સારવાર અર્થે તેમને જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જી.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૧૯૦/૧૯

શહેરકોટડા: હરીશભાઇ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.૨૯)(રહે, ટેકરાવાળી ચાલી અરવિંદ મીલ સામે, નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૪/૦૭/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના લાકડાની વળી સાથે ચાદર બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ઇશ્વરભાઇ સોમાભાઇ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.